



# ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

“રાષ્ટ્રવ ગાંધી ભવન”, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬.

ફોન : (૦૭૯) ૨૬૫૭૮૨૧૨, ૨૬૫૭૮૨૧૩ ફેક્સ : (૦૭૯) ૨૬૫૭૯૫૮૯

website : www.gujratcongress.org • E-mail: gpcc1234@gmail.com

અખબારી યાદી

તા. ૧૯/૦૧/૨૦૨૩

- આંતરરાષ્ટ્રીય કુડના ભાવમાં ૩૨ ટકાનો ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ સરકારની સિદ્ધી : આંતરરાષ્ટ્રીય કુડના ભાવમાં ઘટાડાનો લાભ સત્વરે નાગરિકોને આપવામાં આવે.
- કુડ ઓઈલના સતત ભાવ ઘટાડોમાં ભાજપ સરકાર પોતાની તિજોરી ભરવામાં મસ્ત અને દેશની જનતા ત્રસ્ત

આંતરરાષ્ટ્રીય કુડના ભાવમાં ૩૨ ઘટાડો છતાં પેટ્રોલ – ડીઝલ – સીએનજીમાં અસહ્ય ભાવ વધારાએ લોકોની કમર તોડી નાખી છે. 'અરછે દિન'નાં વાયદા અને વચન આપનાર ભાજપએ દેશ અને ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેવા આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે છેલ્લા ૮ મહિનાથી આંતરરાષ્ટ્રીય કુડ ઓઈલમાં ૩૨ ટકાનો ઘટાડો અને એલપીજીમાં ૪૦ ટકા જેટલો ઘટાડો છતાં સામાન્ય જનતાને ભાવ ઘટાડાનો લાભ આપવામાં આવતો નથી. જૂન ૨૦૨૨થી કુડ ઓઈલ પ્રતિ લીટર રૂપિયા ૫૭ થી ઘટીને રૂપિયા ૩૯ જેટલું થઈ ગયું. આંતરરાષ્ટ્રીય કુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ સરકારની સિદ્ધી છે. કુડ ઓઈલના સતત ભાવ ઘટાડોમાં ભાજપ સરકાર પોતાની તિજોરી ભરવામાં મસ્ત અને દેશની જનતા ત્રસ્ત બન્યા છે. ભાજપ સરકારે જાણે 'લુટતંત્ર' ચાલતું હોય તેમ નાગરીકોના ખિસ્સામાંથી ૨૮ લાખ કરોડ રૂપિયા લૂંટી લીધા છે. ભાજપ સરકારે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણ ગેસ સહિત અનાજ, દાળ, લોટ, ચોખા, દહીં, પનીર, મધ જેવી રોજબરોજની આવશ્યક ચીજવસ્તુઓ પર આકરો જીએસટી ઝીકી પ્રજાનું જીવન જીવવું મુશ્કેલી વધારવાનું કામ કર્યું છે. જેના લીધે દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની ૬ કરોડ જનતા મોંઘવારીનાં મારમાં પીસાઈ રહી છે.

મોંઘવારીને કાબુમાં લેવાને બદલે ભાજપ સરકાર પ્રજા પર આકરો ટેક્સનો બોજ લાદીને પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે. ભાજપ સરકાર ઈચ્છે તો પેટ્રોલ-ડીઝલની કીમતમાં ૧૮ રૂપિયા જેટલો ઘટાડો કરી શકે છે પરંતુ ભાવ ઘટાડવાને બદલે માત્ર એક જ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૧-૨૨માં કેન્દ્ર સરકારે ૭.૭૪ લાખ કરોડ નાણાં અને રાજ્ય સરકારે ૧.૪ લાખ કરોડ ટેક્સ પેટે ઉઘરાવી લીધા છે. પેટ્રોલ-ડીઝલમાં અસહ્ય ભાવ વધારા પાછળ ભાજપ સરકાર અને કંપનીઓ સુનિયોજિત રીતે નગરિકોનાં ખિસ્સા પર લૂંટ ચલાવી રહી છે. છેલ્લા બે વર્ષમાં તુવેરદાળ અને અડદની દાળનો ભાવ અસહ્ય વધીને રૂ. ૧૧૦ને પાર થયો છે. ૪૧૦માં મળતો સિલીન્ડર આજે ડબલથી પણ વધારે ભાવ સાથે ૧૧૦૦માં મળી રહ્યો છે ઉપરથી ગેસ સિલીન્ડરમાં મળતી સબસીડી બંધ કરી દીધી છે. વર્ષ ૨૦૧૪માં પેટ્રોલ પ્રતિ લિટર ૬૪માં મળતું હતું જેને વધારીને ૯૭ અને ડીઝલ પ્રતિ લિટર ૫૪ રૂપિયે મળતું હતું જે વધીને ૯૨ રૂપિયા પહોંચાડી દેવામાં આવ્યું છે. જે સીએનજી કોંગ્રેસના શાસનમાં ૪૨ રૂપિયે પ્રતિ કિલો મળતો હતો જે ભાજપ સરકારે ૮૪ રૂપિયા પહોંચાડી દીધો છે. જંગી ભાવવધારાએ જનતાની કમર ભાંગી નાખી છે.

આર્થિક અસમાનતા વધી રહી છે, બચત કરવાનું તો દુર જીવનનિર્વાહ કરવાનું પણ અધરું બન્યું છે. બેંકોમાં વ્યાજના દર ઘટાડો, રૂપિયાનું સતત અવમુલ્યન અને નાગરિકોની આવકમાં ઘટાડોએ ભાજપની ભેટ છે. આર્થિક બદલાવીમાંથી યુવાનોને બચવાની જગ્યાએ ભાજપ સરકાર પોતાના ઉદ્યોગપતી મિત્રોનું લાખો કરોડો રૂપિયાનું દેવું માફ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, ગરીબ-શોષિત-વંચિત સહીત તમામ વર્ગને આંતરરાષ્ટ્રીય કુડના ભાવમાં ઘટાડાનો લાભ સત્વરે આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

ક્રમ	મહિનો	પ્રતિ લીટર ભાવ
૧	જુન ૨૦૨૨	૫૬.૬૩
૨	જુલાઈ ૨૦૨૨	૫૨.૩૮
૩	ઓગસ્ટ ૨૦૨૨	૪૮.૬૨
૪	સપ્ટેમ્બર ૨૦૨૨	૪૫.૪૭
૫	ઓક્ટોબર ૨૦૨૨	૪૭.૭૭
૬	નવેમ્બર ૨૦૨૨	૪૪.૩૨
૭	ડીસેમ્બર ૨૦૨૨	૩૯.૯૫
૮	જાન્યુઆરી ૨૦૨૩	૩૯.૧૩

(હિરેન બેકર)

પ્રવક્તા